

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલીફોન નંબર ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા..૧૯/૯/૨૦૧૫ શનિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા :-

સમાચાર યાદી નં.૧૮૯૩/૧૫

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૩૩ કેસ કરી અને ૨૫ વ્યક્તિઓને ઝડપી ૭૨૬ લીટર દેશી દારૂ, ૫ બોટલ ઇંગ્લીશ દારૂ અને ૧૦ બિયર ટીન કબજે કર્યા હતા. તેમજ જુગારધારા હેઠળ ૭ કેસ કરી ૩૬ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૭,૬૬,૩૫૫/- જુગારનાં સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલાં હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૮૯૪/૧૫

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલાં હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૨૫ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી.૯૩ મુજબ ૧૧ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

અપહરણ:-

સમાચાર યાદી નં.૧૮૯૫/૧૫

રખીયાલ: દીપીકાબહેન મનસુખભાઈ (ઉ.વ.૧૭)(રહે.નહેરૂનગરના છાપરાં એ.એમ.ટી.એસ.ડેપો સામે સીટીએમ રોડ અમરાઈવાડી) ને ઘર નજીકમાં રહેતો આરોપી સન્ની ભરતભાઈ સોલંકી તા.૧૬/૯/૧૫ બપોરના ૧/૪૫ વાગ્યાના સુમારે રખીયાલ ગવર્નમેન્ટ જી કોલોની નજીકથી લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવી જારકર્મ કરવાના ઈરાદે ભગાડી લઈ ગયો છે. આ અંગેની ફરિયાદ દીપીકાબહેનના પિતા મનસુખભાઈએ તા.૧૮/૯/૧૫ નારોજ રખીયાલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એ બી દેવધા ચલાવે છે.

આત્મહત્યા :-

સમાચાર યાદી નં.૧૮૯૬/૧૫

મેઘાણીનગર: રંજનબહેન ગુલાબજી ઠાકોર (ઉ.વ.૨૭)(રહે.કુબેરનગર બંગલા એરીયા જોગેશ્વરીનગર રબારીવાસ મેઘાણીનગર) એ લગ્ન બાબતે મનમાં લાગી આવતા તા.૧૭/૯/૧૫ રાતના ૧૧/૦૦ થી તા.૧૮/૯/૧૫ કલાક ૪/૦૦ સુધીના સમયગાળા દરમિયાન પોતાના ઘરે લોખંડની એંગલ સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે મેઘાણીનગર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઈ.શ્રી સાગરભાઈ હરીભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.